

શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત અધિકાર

હવે સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મના સંન્યાસના હેતુભૂત શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત અધિકાર કહેવામાં આવે છે.

આ, નિશ્ચય-પ્રાયશ્ચિતના સ્વરૂપનું કથન છે.

ગ્રત, સમિતિ, સંયમ, શીલ, ઈન્દ્રિયરોધરૂપ છે ભાવ જે
તે ભાવ પ્રાયશ્ચિત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩.

અન્વયાર્થ :—ગ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા
ઈન્દ્રિયનિષ્ઠરૂપ ભાવ તે પ્રાયશ્ચિત છે અને તે નિરંતર કર્તવ્ય છે.
॥૧૧૩॥

અહીં (આ ગાથામાં) સકળ કર્મને મૂળથી ઉખેડી નાખવામાં
સમર્થ એવું નિશ્ચય-પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે.

કોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના
ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિતમાં. ૧૧૪.

અન્વયાર્થ :—કોધ વગેરે સ્વકીય ભાવોના (-પોતાના
વિભાવભાવોના) ક્ષયાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણોનું ચિંતન
કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત કર્યું છે. ॥૧૧૪॥

આ, ચાર કષાયો પર વિજ્ય મેળવવાના ઉપાયના સ્વરૂપનું કથન છે.

જીતે ક્ષમાથી કોધને, નિજ માર્દવેથી માનને,
આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. ૧૧૫.

અન્વયાર્થ :—કોધને ક્ષમાથી, માનને નિજ માર્દવેથી, માયાને

આર્જવથી તથા લોભને સંતોષથી—એમ ચતુર્વિધ કષાયોને (યોગી) ખરેખર જીતે છે. ॥૧૧૫॥

અહીં, ‘શુદ્ધ જ્ઞાનના સ્વીકારવાળાને પ્રાયશ્રિત છે’ એમ કહું છે.

**ઉત્કૃષ્ટ નિજ અવબોધને વા જ્ઞાનને વા ચિત્તને
ધારણ કરે છે નિત્ય, પ્રાયશ્રિત છે તે સાધુને. ૧૧૬.**

અન્વયાર્થ :—તે જ (અનંતધર્મવાળા) આત્માનો જે ઉત્કૃષ્ટ બોધ, જ્ઞાન અથવા ચિત્ત તેને જે મુનિ નિત્ય ધારણ કરે છે, તેને પ્રાયશ્રિત છે. ॥૧૧૬॥

અહીં એમ કહું છે કે પરમ તપશ્ચરણમાં લીન પરમ જિનયોગીશ્વરોને નિશ્ચયપ્રાયશ્રિત છે; એ રીતે નિશ્ચયપ્રાયશ્રિત સમસ્ત આચરણોમાં પરમ આચરણ છે એમ કહું છે.

**બહુ કથન શું કરવું ? અરે ! સૌ જાણ પ્રાયશ્રિત તું,
નાનાકરમક્ષયહેતુ ઉત્તમ તપશ્ચરણ ઋષિરાજનું. ૧૧૭.**

અન્વયાર્થ :—બહુ કહેવાથી શું ? અનેક કર્મોના કથનો હેતુ એવું જે મહર્ષિઓનું ઉત્તમ તપશ્ચરણ તે બધું પ્રાયશ્રિત જાણ. ॥૧૧૭॥

અહીં (આ ગાથામાં), પ્રસિદ્ધ શુદ્ધકારણપરમાત્મતત્ત્વમાં સદા અંતર્મુખ રહીને જે પ્રતપન તે તપ પ્રાયશ્રિત છે (અર્થાત् શુદ્ધાત્મ-સ્વરૂપમાં લીન રહીને પ્રતપવું—પ્રતાપવંત વર્તવું તે તપ છે અને એ તપ પ્રાયશ્રિત છે) એમ કહું છે.

**રે ! ભવ અનંતાનંતથી અર્જિત શુભાશુભ કર્મ જે
તે નાશ પામે તપ થકી; તપ તેથી પ્રાયશ્રિત છે. ૧૧૮.**

અન્વયાર્થ :—અનંતાનંત ભવો વડે ઉપાર્જિત શુભાશુભ કર્મરાશિ તપશ્ચરણથી વિનાશ પામે છે; તેથી તપ પ્રાયશ્રિત છે. ॥૧૧૮॥

અહીં (આ ગાથામાં), નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચય-ધર્મધ્યાન જ સર્વ ભાવોનો અભાવ કરવાને સમર્થ છે એમ કહ્યું છે.

**આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને
ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૮.**

અન્વયાર્થ :— આત્મસ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી જીવ સર્વભાવોનો પરિહાર કરી શકે છે, તેથી ધ્યાન તે સર્વસ્વ છે.
॥૧૧૮॥

આ, શુદ્ધનિશ્ચયનિયમના સ્વરૂપનું કથન છે.

**છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાવે આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૦.**

અન્વયાર્થ :—શુભાશુભ વચનરચનાનું અને રાગાદિભાવોનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને નિયમથી (-નિશ્ચિતપણે) નિયમ છે. ॥૧૨૦॥

આ, નિશ્ચયકાયોત્સર્ગના સ્વરૂપનું કથન છે.

**કાયાદિ પરદવ્યો વિષે સ્થિરભાવ છોડી આત્મને
ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧૨૧.**

અન્વયાર્થ :—કાયાદિ પરદવ્યમાં સ્થિરભાવ છોડીને જે આત્માને નિર્વિકલ્પપણે ધ્યાવે છે, તેને કાયોત્સર્ગ છે. ॥૧૨૧॥

આ રીતે, શ્રીમદ્ભગવત્કુંદાચાર્યટેવપ્રાણીત શ્રી નિયમસાર પરમાગમનો શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત અધિકાર નામનો આઠમો શુતસ્કંધ સમાપ્ત થયો.

